

તા. 16 ઓક્ટોબર, 2020 ના રોજ ન્યુ જર્સી ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ (New Jersey Department of Health, NJDOH) એ સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Centers for Disease Control, CDC) ને COVID-19 રસીકારણ યોજનાનો એક મુસદ્દો રજૂ કર્યો. રસી મંજૂર થાય અને New Jersey આવે તે પહેલા યોજના આવનાર મહિનાઓમાં અપડેટ કરવામાં આવશે. આ પૃષ્ઠ યોજના શું ધરાવે છે તેનો એક ટૂંકો સારાંશ તમને આપશે. જો તમને યોજના વધુ વિગતવાર વાંચવાની ગમે તો, [www.state.nj.us/health/cd/topics/covid2019\\_vaccination.shtml](http://www.state.nj.us/health/cd/topics/covid2019_vaccination.shtml) ની મુલાકાત લો.

રાજ્ય COVID-19 રસીકારણ યોજનાનું ધ્યેય છે :

- જેઓ New Jersey રહે છે, કામ કરે છે અને/અથવા શિક્ષણ લીધું છે તે બધાને ન્યાયસંગત એક્સેસ આપવી
- સમુદાયનું રક્ષણ સિધ્ધ કરવું, રસીની અસરકારકતા કાર્યભાર સંભાળવો, પ્રાપ્યતા અને લેવરાવવી.
- COVID-19 અન્ય રસીઓમાં કાયમ ટકી રહે તેવો વિશ્વાસ બેસાડવો.

**ન્યાય સંગત એક્સેસ:** આ યોજના પર કામ કરવા અને રસીની ડિલિવરી કરવા વિવિધ સહયોગીઓને સમાવીને અસમનાતા દૂર કરવાનું ધ્યેય રાખે છે. આ રસી સલામત રીતે, જાણીતા સ્થાનોમાં પૂરી પાડીને; જૂદી જૂદી ભાષામાં માહિતી પૂરી પાડીને; માહિતી સાથે સમુદાયોમાં પહોંચ વધારીને; વીમો ધરાવતા/ વીમો ન ધરાવતા માટે ખર્ચના વિકલ્પોને અને અન્ય અસુરક્ષિત પ્રજાતિ જુથોને ધ્યાનમાં લઈને; અને અવરોધ દૂર કરીને અન્ય સિધ્ધ થઈ શકે.

**તબક્કાવાર પહોંચ:** આ યોજના ત્રણ શક્ય તબક્કામાં રસીનો પુરવઠો અને માંગની જવાબદારી ધરાવે છે. 1.) રસીની માત્રા મર્યાદિત બનાવે, 2) પુરવઠો જે માંગને પહોંચી વળવા સક્ષમ બને અને 3.) જાહેર માંગની ગતિ ધીમી પાડે

**જાહેર વિશ્વાસ-** NJDOH જાગૃતિ ઊભી કરશે, શિક્ષણ આપશે અને જાહેર આરોગ્ય અને આરોગ્ય સહયોગીઓ અને જનતામાં ચિંતા ઠીક કરવા વિજ્ઞાન-આધારિત જાહેર આરોગ્ય અને વિશ્વાસુ સ્ત્રોતોમાંથી તબીબી માહિતીનો ઉપયોગ કરીને ગતિવિધિ સક્રિય બનાવશે.

**રાજ્યની નેતાગીરી-** રાજ્યના બધા વિભાગો, સહિત, “સમગ્ર ખાતાઓ” દ્વારા રસી ન્યાયસંગત રીતે આપવામાં આવી રહી છે અને કે કોઈ પણ જૂથને અન્યાયિકરિતે પાછળ છોડી દેવામાં નહીં આવે એવી ખાતરી આપવા સાથે સમસ્યા હાથ પર લેવામાં આવી રહી છે.

**નિષ્ણાંતી માર્ગદર્શન-** રાજ્યના નેતાઓએ વિષય વસ્તુના નિષ્ણાંતો તૈયાર કર્યા છે અને New Jersey નેતાઓ આ પ્રક્રિયા દ્વારા માર્ગદર્શન આપે તેવું વિચાર્યું છે અને આમ કરવાનું તેઓ રસી આવે ત્યાં સુધી ચાલુ રાખે.

**સંકટપૂર્ણ વસ્તીઓ –** તબક્કા 1 દરમિયાન એવી ખાતરી રાખવી અગત્યની હશે કે જેઓ COVID-19 સંક્રમણના સૌથી વધુ જોખમ પર છે, જેઓ વધુ ગંભીર બીમારી કે મૃત્યુના જોખમ પર છે, કે જેઓ પછાત વસ્તીઓમાં છે – રંગના સમુદાયો સહિત- જેઓ સર્વવ્યાપી મહામારીથી અસમાનરીતે આર્થિક પ્રભાવ પામ્યા છે, તેઓને રસી સૌ પ્રથમ આપવામાં આવે.

**સમયસર પ્રથમ-ડોઝ પહોંચાડવી અને બોજ ડોઝના રિમાઇન્ડર્સ -** એવી ખાતરી રાખવા સાથે કે લોકો રસીનો બરાબર માત્રમાં ડોઝ મેળવે તેવી વિવિધ રીતો અને એક નોંધ રાખવામાં આવે.

**કાર્યદક્ષ અને અસરકારક સ્થાનિક ડિલિવરી-** આ યોજનાઓ પોઇન્ટ્સ ઓફ ડિસ્પેન્સિંગ (Points of Dispensing, PODs) નો ઉપયોગ કરવા ગોઠવાયેલી હોય કે જે રસીની અનુકૂળ ડિલિવરી માટે રાજ્યભરમાં સ્થિત હોય. રસીની યોગ્ય સંચાલન વ્યવસ્થા અને સંગ્રહ માટે NJDOH સહયોગી સંસ્થાઓ સાથે કામ કરી રહી છે.

**સંકલનપુર્ણ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ:** NJDOH ની ન્યુ જર્સી ઇમ્યુનાઇઝેશન ઇન્ફોર્મેશન સિસ્ટમ (NJ Immunization Information System) કેન્દ્રીય નોંધણી કચેરી, ઓર્ડર આપવા માટેની સિસ્ટમ અને COVID-19 ના રસી રિપોર્ટિંગ સિસ્ટમ તરીકે સેવા આપશે જેથી સ્ત્રોતોની યોગ્ય ફાળવણી થઈ શકે.

**રાજ્યવ્યાપી પ્રોગ્રામ મોનિટરિંગ-** આ સઘળી પ્રક્રિયા દરમિયાન, રસીકારણ કાર્યક્રમની દેખરેખ રાખવાના પગલાં લેવામાં આવશે એવી ખાતરી સાથે કે કાર્યક્રમ યોજના મુજબ આગળ વધી રહ્યો છે અને જેથી જ્યારે જરૂર હોય ત્યારે સુધારક પગલાંઓ લઈ શકાય.